



DBM-1601250502030103 Seat No. _____

M. A. (Sem. III) (CBCS) (W.E.F. 2016) Examination

June - 2022

Economics

(Economics of Financial Management)

Time : **2.30** Hours]

[Total Marks : **70**

- સૂચના : (1) બધા જ પ્રશ્નોના ગુણ સરખા છે.
(2) કોઈપણ પાંચ પ્રશ્નોનાં ઉત્તર આપો.

- | | | |
|----|---|----|
| 1 | મોડીગલીયાનીનો અભિગમ સમજાવો. તેની સમિક્ષા કરો. | 14 |
| 2 | મૂડી અંદાજપત્રનું અર્થશાસ્ત્ર વિગતે ચર્ચો. | 14 |
| 3 | ડિવિડન્ડનું અર્થશાસ્ત્ર વિગતે ચર્ચો. | 14 |
| 4 | ઈષ્ટતમ કેસ બેલેન્સ અંગેનો બોમલનો અભિગમ સમજાવો. | 14 |
| 5 | ગુણોત્તર વિશ્લેષણ (Ratio Analysis) અને રોકડ પ્રવાહ વિશ્લેષણ (Cash Flow Analysis) સમજાવો. | 14 |
| 6 | કાયા માલની કિંમતોમાં થતાં ફેરફારો સામેનું આયોજન સૂચવો. | 14 |
| 7 | કંપની મૂલ્યાંકન (Corporate valuation)ના સિદ્ધાંતો સમજાવો. | 14 |
| 8 | આર્થિક મૂલ્ય મૂલ્ય વૃદ્ધિ અભિગમ (EVA) વિગતે સમજાવો. | 14 |
| 9 | ટૂંકનોંધ લખો :
(1) કાર્યશીલ મૂડીનું મહત્વ
(2) ગ્રાહકોનું વર્ગીકરણ | 14 |
| 10 | ટૂંકનોંધ લખો :
(1) સંપાદનનું અર્થશાસ્ત્ર
(2) નાણાકીય અર્થશાસ્ત્ર સંચાલનનું કાર્યક્ષેત્ર | 14 |

ENGLISH VERSION

Instructions : (1) All questions carry equal marks.
(2) Answer any five questions.

- | | | |
|-----------|--|-----------|
| 1 | Explain Modigliani approach. Evaluate it. | 14 |
| 2 | Discuss in detail economics of capital budgeting. | 14 |
| 3 | Discuss in detail economics of dividend. | 14 |
| 4 | Explain Baumol model for optimal cash balance. | 14 |
| 5 | Explain ratio analysis and cash flow analysis. | 14 |
| 6 | Suggest planning against pricing change in raw materials. | 14 |
| 7 | Explain theories of corporate valuation. | 14 |
| 8 | Explain in detail economic value added. | 14 |
| 9 | Write short note :
(1) Importance of working capital.
(2) Customer classification. | 14 |
| 10 | Write short note :
(1) Economics of acquisition.
(2) Scope of management of financial economics. | 14 |